



સ્તરપાન અને પૂરક આહાર માર્ગદર્શિકા

ભારતીય જ્ઞાનપાન પ્રસાર કાર્યજ્ઞાલ (બિ.પિ.એન.આઈ) તરફથી
(From Breastfeeding Promotion Network of India)

આપણ અને ખાસ કરીન સ્વાચ્છ મુજબલે ગર્વિકતી અને ધાર્યી માતાઓને બાળકો માટે પુરતાધારની દોષ્ય પોથી પણ પણ વિષયે ઓક્કડું માહિતી પૂરી પાડું વાંચ વિધિ એન આઈ સતત પ્રયત્નશીલ છે. જેણા પરિચાલન અનુરૂપ આ દસ્તાવેજ છે. આરોગ્ય અને આધુનિક સંખ્યાઓ સામાજિક સંસ્થાઓ અને સમાજ કાર્યક્રમ રસ્તો ઘરાવનાર બધી જ વ્યક્તિનો માટે આ દસ્તાવેજ માતાઓને સચોટ માહિતી આપવા માટે વિષયોગી રહેશે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અન વિશ્વ આરોગ્ય કલા (WHA) ના તા. ૧૮-૫-૨૦૧૧ ના દશાય પદ્ધ-૨ ની ભવામણી તેમજ વિશ્વભરની અનેક સંસ્થાઓની ભવામણોની આધારે આ માર્ગદર્શિકા જનાવેલી છે. છ મદિનાની ઉમ્મર સુધી આપણ માટે ઘરબા એક અનુકૂળ, પોષક, સરક્કારી એવો સુપૂર્ણ અને સુવૃત્તિમન પોરાંક હોય છે. છ મદિના સુધી માત્ર ઘરબા ઊપર ઉકરેલા બાળકોનું જવન પૂછ ઉભારે પણ નિરામય રહે છે. સનપાન કેવળ બાળક માટે જ નહીં પરંતુ તેની માતા, તેનું કંડેલ, સમાજ અને રાષ્ટ્ર માટે પણ લાભદારી હોય છે.

૧ સત્તનપાનની શરૂઆત

- ◆ અડવા કલાકમાં જી : જન્મ પછી તરત જી, બાળકો કોરા લુગપથી લુણીને, માતાની નિકટ, શરીરને અડીને મુકું અડવા-એક કલાક સુધી બાળક સજીગ હોય છે અને ત્યાર પછી સુઈ જાય છે. તેથી જેટલું વહેલું બને તેમ બાળકને માતા સાથે વળગાડવું, નવ્યાવવં, વજન, કપડા વગેરે તે પછી જી કરવાં. બાળક સતતને મોહું લગાડે ત્યારે માતાના શરીરમાં ઓડિક્સટોસિન નામની અંતસ્ત્રાવ વધી જાય છે. જેના પરિજ્ઞામે સ્નાયુઓ સંકીચાવાથી માતાની છાતીમાંથી દૂધ ઘાયલ રૂપે બહાર આવે છે. બાળકને જન્મ પછી ૧/૨ કલાકમાં જી નવ્યાવવાના ભીજા પણ કાયદા છે.
 - ◆ બાળકને ખીરું મળું જ જ્ઞેઈએ : રડભાતનું દૂધ જરા જુદુ (જાહુ અને પાણુ) હોય છે. જેને ખીરું કરેવામાં આવે છે. તે ખરાણ છે એવું માનનીન કાઢીને ફંકી દેવામાં આવે છે તે મોટી ભૂલ છે. ખરેખર તો નવજાત બાળકને માફક આવે તેવા પોપક અને રોગપતિકારક તત્વાથી ખીરું બરપૂર હોય છે. એક રીતે બાળક માટે તે પહેલી રોગપતિબંધક રહ્સી છે.
 - ◆ માતાને ઓછો રક્ત સ્વાવ : બાળકને જન્મ પછી તરત જી નવ્યાવવાથી ગર્ભશાપના સ્નાયુ પણ સંકોચાય છે. અને સુવાપદ પછી બતો રક્તસ્વાવ ઓછો રહે છે.
 - ◆ માનસિક સેતુ : જન્મ પછી તરત જી બાળકને માતાની નિકટ મુકૃવાથી બને માનસિક રીતે પણ નિકટ આવે છે તેમની વચ્ચે બાબના સેતુ બંધાય છે.
 - ◆ ગળથૂથી આપવી રહી : જન્મ પછી તરત જી બાળકને થી, ગોળ, મધ્ય, વગેરે ચટાડવાના/ખીવડાવવાની પ્રથાલિકા તરફની પાયા વગરતી અને જોખમભરી છે. તેના કારણે બાળકની ભૂખ અને ઘાયલની ઠિક્સા પડે છે. અને વહેલું જન્મપાન આપવું અઘરું બને છે. સાથે સાથે બાળકને ચેયે બાળવાનો ભય પણ રહે છે.

२ ७ महिना सूधी मात्र धावण

બાળકને જ મહિના પૂર્ણ ચાય ત્યાં સુધી ધાવણ સિવાય
કરું જ આપણું નહીં દા.ત. ચમચો, જન્મ ગુટી, બોનિસાન,
ગ્રાઇફ વોટર, સોમવા વગેરે. પાછી પણ નહીં. વિટામિનના
ટીપા આપવા હોય તો ચાલે. બાળક માંદું હોય, તેને પીડા થાણી
છેય તો પોગ્ય દવા તે સમય પૂર્તી જરૂર આપવી પણેતુ તંહુરસ્લ
બાળકને ધાવણ સિવાય ડેઈપલ વસ્તુ નિયમિત રીતે, રેજની રેજ
પીવાપણી નહીં.

- ◆ **પાણી બીજુદ્દુરી :** ભાળકને ધ્યાનદામણી પૂરતુ પાણી મળે છે. ગર્ભીના ડિવસોમાં પણ જુદુ પાણી પીવડાવાની જરૂર હોતી નથી. પાણી પીવડાવીને તો ભાળકની ધ્યાનદામણી હિંદુઓએ થાય અને ચેપ લાગવાનો ભય રહે. રોડ ડલાકમાં ક વાર સારો એવો પેશાબ થતો હોય તો ભાળકને પાણીની જરૂર નથી તેમ સમલું દેવું. અન્ય પસુંઓ પણ તે જ કારણસર પીવડાવી નથી. ૭ મહિના સુધી ભાળકને માત્ર સ્તનપાણ આપવું એ ભાળક અને માતા બન્ને માટે લાભદાયક છે.
 - ◆ **રોગો સામે રક્ષણ :** જન્મ વખતે ભાળકોમાં રોગ પ્રતિકારક તત્ત્વો બનાવવાની કમતા હોતી નથી. ધાવણ મારફતે તેમને આ તત્ત્વો મળે છે. એટલે ભાળકને ચેપી રોગો સામે રક્ષણ મળે છે. ૭ મહિના સુધી કંડત ધાવણ પીંફેલ ભાળકોની સરાનામણીમાં પહોંચેથી જ બદાનું દૃઢ પીવડાવેલ ભાળકોમાં જાગ્રાતિકાંતી, શરદી-માત્સી જેવા રોગોનું પ્રમાણ ૫-૧૫ ગંધુર વધુરે હોય છે.
 - ◆ **બાળ આરોગ્ય અને વિકાસ :** છ મહિના સુધી કંડત ધાવણ પીંફેલ ભાળકો શારીરિક અને માનસિક રોતે વધારે તહુરસા હોય છે. તેમને છદ્યરોગ, લોહીનું દ્ઘબાદ, મધુપમેહ (ડાયાનિટિસ), ચાંદાની બીમારી વગેરે તેમજ દમ, ખરાણું, જેવી એલાર્ટિક તકદીદી ઓછા પ્રમાણમાં રહે છે. તેમનો શારીરિક માનસિક પ્રવૃત્તિનો વિડાસ વધારે સારો હોય છે. તેઓ વધારે બુદ્ધિમાળી અને સમજું હોય છે.

◆ माताने लाभ : स्तनपानथी माता मानसिक तृप्ति अने स्वस्थता अनुभवे छे. सगभावस्थामा क्रेकार थपेला अंगोने पूर्वस्थिति प्राप्त करवा माटे स्तनपान मददरूप थाप छे. मोटी उम्हरे स्तन अने अंडाशयना तेनसरनु प्रमाण ओहुँ रहे छे.

◆ कुटुंब नियोजनमां मददरूप : बाणकने ७ महिना सुधी धावल सिवाय क्षुं ज आप्यु न होय तो करीथी मासिक आवपानु ५ थी ८ महिना ठेलाप छे. तरत गर्भधारणा थतु नही. ५ महिना सुधी बाणकने मात्र धावल आपहुँ एकुटुंब नियोजन माटे (बे बाणको वज्ये गाडो राखवा माटे) मददरूप थाप छे.

३ स्तनपाननी योग्य पद्धति

पश्चात्यी स्तनपान माटे बाणकनी धाववानी पद्धति योग्य होवी ज्ञेहिए. धावल स्तननी ग्रेडीओमां अने त्याई स्तनमंडण (टीडी पाइणनो डाढो भाग) नी नीचे रहेली पहाडी नविकाओमां उतरे छे. स्तनमंडण मोडामां होय तो ज बाणक छबना दबाक थी दृष्टिनी नविकाओमांथी धावल भेंयीने लही शके. बाणक ज्ञे सहेज ज मोहुँ खोलीन, डाटी पकडीन, युसे तो बाणकने पूरतु धावल मानतु नही (चित्र-१, २) दृष्टिनो भरावो थाप छे अने धावल ओहुँ थई जाप छे. माताने डिटीमां तीराड, स्तनमां सोजे, स्तनपाक जेवी पीडा थाप छे.

४ बोटल, बोथी, चूसली आपवी नही बाणकने बोटल, बोथी, चूसली अपाती होय तो तेने मोहुँ सहेज खोलीने चूसवानी आदत परी जाप छे. तेथी बाणकने क्रोहिपक्ष वज्यते बोटल, निपल, बोथी के चूसली आपवी नही.

५ बाणकनी ईच्छा मुजख, मांगो त्यारे, वारे घडीअे धवडावो


सामान्य रीते बाणको पोताने माटे स्तनपाननु समयपत्रक नक्की करता होय छे. तो पक्ष कोई वज्यते वहेली (क्लाक-दोह त्वाक्तमां ज) अने क्रोहि वज्यते मोटी (४-५ क्लाके) भूम लागे छे. क्रोहि बाणको २-३ मिनिटमां ज झरते तेत्खु धावल मेलावी ले छे. तो क्रोहिने देढक बाजुमे १५-२० मिनिट लागे छे. बाणकने क्यारे अने केटवा समय माटे धवडावतु तेनो नियम करी राख्य नही. बाणकने समयपत्रक प्रमाणे धवडावपामा आवतु होय तो बाणकने वहेली भूम लागे तो ते रीते थाकी जाप अने निर्धारित समये भरोबर थावे नही. अने जे निर्धारित समये बाणक भूम्हो न होय तो पक्ष भरोबर धावरो थतो नही.

चित्र १. स्तनपाननी पद्धति



- | योग्य | अयोग्य |
|--|---|
| • मा बाणकनी नजरमां नजर मेणवे छे. | • मातानी नजर बाणक सामे नजर मेणवे छे. |
| • बाणकनु माथु (अने गाईन गाईन) सीधुं अथवा थोडु पाइण नमेलु छे. | • बाणकनु माथु (अने गाईन गाईन थोडु आगण नमेलु छे). |
| • बाणकनु शरीर माता तरक तरक वरेलु छे. | • बाणक शरीर माता तरक तरक वरेलु नही. |
| • बाणक माताना शरीरनी निकट छे. | • बाणक माताना शरीर थी हूर छे. |
| • बाणकना आआ शरीरने माताना धायनो आधार राखेलो छे. | • बाणकना शरीरने ज्वर पक्ष आधार आपेलो नही. इक्त मेनु माथु उथु खेलु छे. |

चित्र २. बाणकनी धाववानी पद्धति



- | योग्य | अयोग्य |
|--|---|
| • बाणकनी दाढी स्तनने अडेली छे. | • बाणकनी दाढी स्तनधी हूर छे. |
| • बाणकनु मोहुँ एकदम पहेलु लाई नीयेनो होठ अडार वरेलो छे. | • बाणकनु मोहुँ सहेज खुल्लु छे. अने ते बन्न होठ आगण काढीने उटी यसे छे. |
| • लगभग संपूर्ण स्तनमंडण (भास करीने नीयेनो भास) बाणके मोडामां लीधुं छे. | • लगभग आप्यु स्तनमंडण मोडानी अडार देखाय छे. |
| • बाणक आ रीते धावे तो माताने डिटीमां हुमावो थाप छे. | • बाणक आ रीते धावे तो माताने डिटीमां हुमावो थाप छे. |

નહીં. આવી પરિસ્થિતિમાં ગ્રંથીઓમાં ધાવક બરેલું રહે અને દૂધનું ઉત્પાદન ઘટી જાય છે. તેથી બાળકન માંગે ત્યારે, તેના ઠિક્કા હોય ત્યાં સુધી ઘવડાવવું જોઈએ.

બાળક રજુ હોય તો તેને દૂધ ઓછું પડે છે એવું મનીને ઉત્તાવળે બધારનું દૂધ ચાલુ કરવામાં આવે છે તે ખોટું છે. બાળકને ૨૪ કલાકમાં ૫ વાર સારો એવો પેશાબ થતો હોય તો તેને મુર્ચું ધાવક મળે છે એવું માણી શકાય. ખરેખર જો ધાવક ઓછું પડજું હોય તો પણ બધારનું દૂધ ચાલુ કરવાની જરૂર નથી. ધાવક વધારવાનો સાચો ઉપાય છે બાળકને વારે વડીએ ઘવડાવવું. દૂધ-ગ્રંથીઓ ભરેલી રહેતી હોય તો દૂધ ઉત્પાદન વટે અને ખાલી થાય તો ધાવક વધે. સ્તનપાન પછી ૧/૨ કલાકમાં ૫ બીજું ધાવક તેચાર થાય છે. તેથી બાળકને ધાવક ઓછું પડજું હોય તો વારે વડીએ ઘવડાવવાથી ધાવક વધે અને બધારનું દૂધ ચાલુ કરીને તો ધાવક ઘટે. દૂધ ઉત્પાદન માટેનો જરૂરી પ્રેરક અંતસ્ત્રાવ (પ્રોલેક્ટિન) નું પ્રમાણ રાને વધારે હોય છે. તેથી ધાવક ઓછું પડે છે એવું લાગતું હોય તો રાત્રે પણ વારે વડીએ ઘવડાવવું.

૬ ઘરની બાહાર કામ કરતી માતાઓ અને સ્તનપાન

◆ સામાજિક જવાબદારી : છ મહિના સુધી માત્ર સનપાનનથી બાળકોને ઉછેદવા માટે મદદરૂપ થાય તેવી પરિસ્થિતિ નિર્માણ કરવાની નેતૃત્વ જવાબદારી સરકારે સ્પીકરેલી છે. સુવાવડ માટે રજા, કાર્ય-સ્થળે ઘોઉંયાઘર, કાર્ય સમય દરમિયાન સનપાન માટે બે વધારાના વિશ્રામ (nursing break), દૂધની પાપડર, ભાલ આધ્યાત્મિક અનુભૂતિ માટે વધારાના પ્રતીનિયત માટેના કશ્યપા અને નિયમો ઘઠાયેલા છે. પણ તેના લાભ માત્ર સરકારી નોકરોને જ મળે છે. આ બધી સંગ્રહો બાળકો અને રાજ્યના દિલમાં છે તેનું ભાન ખાનગી કેત્રમાં દેખાતું નથી.

◆ રજા : પાત્રી માતાને જો શક્ય હોય તો ૫ મહિના સુધી (જરૂર પડે તો જિન પગારી) રજા અવસ્થ લેવી પણ તે શક્ય ન હોય તો શું કરવું ?

◆ ઘોઉંયા ઘર અને સનપાન-વિશ્રામ : કાર્ય સ્થળે ઘોઉંયા ઘર હોય તો બાળકને ત્યાં ચાખવું અને સનપાન વિશ્રામ દરમિયાન (કુલ ૩ વાર) બાળકને ઘવડાવવું. કાર્ય સ્થળે ઘોઉંયાઘર ન હોય અને રહેઠાજી નજીક હોય તો વિશ્રામ દરમિયાન વેરે જઈને અથવા બાળકને કાર્યસ્થળે લાવીને ઘવડાવવી શકાય.

◆ કાઢેલું ધાવક : રહેઠાજી કાર્યસ્થળથી દૂર હોય તો શું કરવું ? કાર્યસ્થળે અલગ ખાનગી ચોખ્ખો કમરો અને રેફ્રિજરેટર હોય તો વિશ્રામ દરમિયાન ધાવક કાઢીને, ઉકાળેલાં ચોખ્ખા ઊભામાં લેગુ કરીને કિજામાં રાખવું અને વેરે લઈ જઈ ત્યાં પણ કિજામાં રાખવું. એરે આવ્યા પછી બીજે દિવસે કમે જવા નીકળવું હોય ત્યાં સુધી (રાત્રે પણ) બાળકને વારે વડીએ ઘવડાવવું. માતાની ગેરદાજીનીમાં આગળા દિવસે કિજામાં રાખેલું ધાવક બલાર કાડી સામાન્ય તાપમાન થાય કે બાળકને પીવડાવવું. કાઢેલું ધાવક સામાન્ય તાપમાનમાં ૮ કલાક સુધી અને કિજામાં રાખ્યું હોય તો ૨૪ કલાક સુધી વાપરી શકાય. કાઢેલું ધાવક ઉકાળવું નહીં.

◆ કાર્યસ્થળે કશીજ સગવડ ન હોય તો : તો પણ માતાની ગેરદાજીનીમાં બાળકને ધાવક મળે તેવી પ્રયત્ન કરી શકાય. કમે ચચાતાં પદેલાં ૨-૩ અઠવાણીયા અગાઉથી માતાએ બાળકને ઘવડાવ્યા પછી, રહેલું ધાવક કાડી નાખવું. દૂધ-ગ્રંથી ખાલી થાય એટલે વધારે ધાવક ભરાય. ધીમે ધીમે ધાવક વધતું જાય અને કામે જતાં પદેલાં ૧-૨ વાર પૂરું પડે એટલું તો ધાવક કાડીને રાખી શકાય.

૭ માતા/બાળક માંદું હોય તો ?

સામાન્ય માંદગીમાં સનપાન ચાલુ જ રાખવું. માતાને થયેલ બીમારીની અને આપેલ દ્વારાની સામાન્ય રીતે બાળકને આહાશમાર થતી નથી. બાળક બહુ જ માંદું હોય, બહુ જ નભળું કે અદ્યુતે મહિને ફન્નેલું હોય તો તે ભરાબર ધાલી રસ્તું નથી. આવે વખતે ધાવક કાડીને બાળકને કષપ/ચમચીથી પીવડાવવું પડે છે.

બાળક ગન્ભીર રીતે માંદું હોય અને મોઢેથી કશું પણ આપવાની હેક્ટરે ના પારી હોય તો દર ૨-૩ કલાકે ધાવક કાડી નાખવું. ધાવક ભરાઈ રેસે તો બાળક સરુ થાય ત્યાં સુધી ધીમે ધીમે ઓછું થઈ બંધ થઈ જશે.

૮ ખાસ સંજોગોમાં ધાવકો

જોઉંયા બાળકો, ખોટખાંપણવાળા બાળકો વગેરે ખાસ સંજોગોમાં પણ બાળકને ધાવક તેવી રીતે પીવડાવી શકાય તે માટે ડૉક્ટરની સલાહ વો.

૬ બે વર્ષ સુધી કે તેથી પણ વધારે સમય માટે ધાવક ચાલુ રાખો

પહેલા એ મહિના સુધી બાળકને ધાવક સિવાય બીજું કશું જ આપવું નહીં. છ મહિના પૂરા થયા પછી બાળકને પૂરક ખોરાક ચાલુ કરવો પણ સાથે સાથે ધાવક પણ ચાલુ રાખવું. બાળક ખાતાં શીખે એટલે સંનપાન ઓછું થશે પણ સંનપાનથી બાળકને થોડી વધારે પોપક અને રોગપ્રતિકરણ તત્ત્વો મળતાં રહેશે અને માનસિક હુંક અને આસ્વાસન પજી મળશે.

૧૦ પૂરક ખોરાક :

- ◆ કયારે ? છ મહિનાની ઉમ્મર પછી બાળકની આખારની બધી જરૂરિયાતો એકલું ધાવક પૂરી પારી રાખતું નથી. તેથી સાતમાં મહિને પૂરક ખોરાક રાહુ કરવી અગત્યાનું લોષ છે. છ માસ પહેલાં પૂરક ખોરાક ગરૂ કરવાથી કોઈ કાયદી થતો નથી તેથી તે ધાવકની જગ્યા વે છે, બાળકને પોપક અને રોગસંરક્ષણ અપોષ્ટું મળે છે. પૂરક ખોરાક ભલું મોહે ચાલુ કરવાથી બાળક નભણું સે છે.
- ◆ કેટલીવાર ? : શરૂઆતમાં ધાવક ઉપરાંત એકવાર ખોરાક આપવો, ૮-૧૫ મહિને ૨-૩ વાર, ૧૦-૧૨ મહિને ૩-૫ વાર.

◆ કેવો ?: શરૂઆતમાં ખોરાક પ્રવાહી-ચમગીથી રેઝી શકાય અને બાળક ગળી રહેતે તેવો હોવો જોઈએ, છતાં જિલ્લાલ પાણી જેવો નહીં. અનાજ, દાળ, કઠોળ, શાકભાજું વગેરે બાણીને તેને સુપ જેણું બનાવવું અથવા ચોખા, ઘઉં, ભાજરો, રાજી વગેરેનો લોટ થી ઉપર રોકીને દૂધમાં ગોળ / ખાડ સાથે ખીર, લાપસી, રાબ જેણું બનાવવું. શરૂઆતમાં બાળક મેવો ખોરાક ના સ્વીકારે તો બનારના દૂધને બદલે માં નું દૂધ વાપરવામાં આવે તો તેનો સ્વાદ પરિચિત હોવાને કારણે બાળક સહેલાઈથી ખાશે. બાળકને કાવે તે અનુસાર ખોરાક થીમે થીમે ઘટ કરીએ તો ૮-૧૦ મહિને બાળક કીલો ગીરો, મસાંગેલાં બાળદાળ/ખીચી વગેરે ખાઈ રહે. એક વર્ષની ઉંમરે વરમાં રંધેલી બધી જ નરમ ખોચી વાનગી બાળક ખાઈ શકે છે. ખોરાકમાં શક્ય હોય તેટલી વિવિધતા રાખવી. બાળકની રોકી પ્રમાણે ગળપ્રકા (ગોળ, ખાડ), ખટકા (દાઢી, લીણું, રામેટા), માંદું, મસાલો (મરચાં વગર) તેમજ મોસમનું ફળ ઉમેરી શકાય.

◆ કેવી રીત ?: બાળક જેટલું ખાઈ રહે તેટલું ખવડાવો. ભલું આગ્રહથી, પરલો પકડીને, જોર જબરદસ્તીથી ખવડાવશો નહીં. તેથી બાળકને ખોરાક પ્રત્યે અણવિ ઘૃસ્થા પેદા થશે, ચીરજ અને સમજાવટથી બાળકને રોકી અને હંચા પ્રમાણે અને જરૂર પડે તો થોડી થોડી વારે તેને ખાવાનું પ્રોત્સાહન આપો.

ધ્યાનમાં રાખો

બાળકને છ મહિના પૂરા થાં સુધી ધાવક સિવાય બીજું કશું પીવડાવશો નહીં.
છ મહિના પૂરા થયા પછી પૂરક ખોરાક ચાલુ કરો પરંતુ ધાવક બંધ કરશો નહીં.
બે વર્ષ સુધી કે તેથી પણ વધારે સમય માટે ધાવક ચાલુ રાખો.

This document has been produced as an activity of the BPNI- IBFAN South Asia's Resource Centre on Infant & Young Child Feeding under the IBFAN - GIFA Project WW 033 207, 2000-2002 "Strengthening breastfeeding activities at grassroot level" with the support from Dutch Ministry of Co-operation and Development (DGIS).

For more information, please contact :

Breastfeeding Promotion Network of India (BPNI)/ IBFAN South Asia

BP- 33, Pitampura, Delhi 110 088 (INDIA)

Tel : +91-11-7443445, Tel/Fax : +91-11-7219606

Email : bpni@bpni.org

Website : http://www_bpni.org

BPNI-2001/Document 4/Gujarati



Copyright © 2001 by BPNI
All rights reserved.
No part of this document may be reproduced without permission and/or written consent of the author.

The 'Guidelines' may be reproduced unchanged as a service to the community. 100 copies (Gujarati) may be obtained for Rs=100/- from the BPNI Office or from the Gujarat State Co-ordinator (Tel : 0265 - 420587, e-mail : atphatak@satyam.net.in).